

ફેબ્રુઆરી 13, 2019

ફેમિલી ડે 2019 ઇન બ્રામ્પટન (બ્રામ્પટનમાં કુટુંબ દિવસ 2019)

બ્રામ્પટન, ઓન્ટેરિયો – ફેમિલી ડે આપણાં સમુદાયમાં કુટુંબોના મહત્વને ઉજવે છે. બ્રામ્પટનવાસીઓને પોતાના પ્રિયજનો સાથે સમય વિતાવવા પ્રોત્સાહિત કરવામાં આવે છે!

આ વર્ષે, ફેમિલી ડે સોમવાર, ફેબ્રુઆરી 18, 2019 નાં રોજ યોજવાનો છે, અને પરિણામ સ્વરૂપે, શહેરની સંખ્યાબંધ સેવાઓ અનુપલબ્ધ રહેશે અથવા સેવાના ઘટાડેલા સ્તરો સાથે કાર્યરત રહેશે.

બ્રામ્પટન સીટી હોલ ફેમિલી ડે નિમિત્તે બંધ રહેશે. રહેવાસીઓ આ સમય દરમિયાન રૂબરૂમાં મેરેજ લાઈસન્સીસ મેળવવા અરજી કરી શકશે નહિ, નાગરિક લગ્ન સમારોહોનું બુકિંગ કરાવી શકશે નહિ, પાર્કિંગ ઇંડ ચૂકવી શકશે નહિ અથવા પરમીટ્સ મેળવવા કે તાજી કરવા અરજી કરી શકશે નહિ અથવા ધંધાકીય પરવાનાઓ માટે અરજી કરી શકશે નહીં.

ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ અને સીટી ઓફ બ્રામ્પટન બાય-લો એન્ફોર્સમેન્ટ સહિતની, સંખ્યાબંધ સેવાઓ રાખેતા મુજબ ચાલુ રહેશે.

ફેમિલી ડે પ્રવૃત્તિઓની સંપૂર્ણ યાદી માટે, કૃપા કરી 311 નંબર પર કોલ કરો અથવા વેબસાઈટ જુઓ, www.brampton.ca.

બ્રામ્પટન ટ્રાન્ઝિટ

બ્રામ્પટન ટ્રાન્ઝિટ રવિવાર/રજાના દિવસની સેવા સોમવાર, ફેબ્રુઆરી 18 નાં રોજ પૂરી પાડશે. બ્રામ્પટન ટ્રાન્ઝિટના ટર્મિનલ્સ પર ગ્રાહક સેવા કાઉન્ટર્સ બંધ રહેશે.

રૂટ અને સમયપત્રક માહિતી માટે, 905.874.2999 નંબર પર ફોન કોલ કરો અથવા વેબસાઈટ જુઓ, www.bramptontransit.com. રિયલ-ટાઈમ (વાસ્તવિક સમયે) આગામી બસ માહિતી મેળવવા તમારા સ્માર્ટ ફોન કે અન્ય મોબાઈલ સાધન પર વેબસાઈટ nextride.brampton.ca જુઓ. અન્ય પ્રવાસી આયોજનને લગતા સાધનો માટે વેબસાઈટ www.triplinx.ca અથવા ગૂગલ મેપ્સ જુઓ.

બ્રામ્પટન રિક્લિએશન

સોમવાર, ફેબ્રુઆરી 18 નાં રોજ, આખું કુટુંબ આનંદ માણી શકે તે માટે સમગ્ર શહેરમાં રિક્લિએશન સેન્ટર્સ મનોરંજનલક્ષી કાર્યક્રમો આપશે. બ્રામ્પટનવાસીઓને કાર્નિવલ ગેમ્સ, ગો જીઓકેશિંગ, સ્નોશૂ, સ્કેટ રમવાનું, અને અન્ય વૈવિધ્યસભર પ્રવૃત્તિઓમાં સહભાગી થવાનું આમંત્રણ આપવામાં આવે છે.

વિંગકુસી પાર્ક, ગોર મેડોસ કમ્યુનિટી સેન્ટર, અને ગેજ પાર્કમાં શ્રેણીબદ્ધ કૌટુંબિક અનુકૂળ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. આ ફેમિલી ડે આયોજનોમાં એક દિવસીય સ્કી/સ્નોબોર્ડ લેશન્સ, ટ્યુબિંગ, ફાયર પિટ, કાફ્ટસ, કૂકી સુશોભન અને ઘણી બધી લાક્ષણિકતાઓ જોવા મળશે.

બ્રામ્પટનમાં ફેમિલી ડે નિમિત્તે કમ્યુનિટી સેન્ટર્સ અને પાર્ક્સમાં થનારી પ્રવૃત્તિઓની સંપૂર્ણ યાદી માટે, [અહીં ક્લિક કરો](#). ફી લાગુ પડી શકે.

ફેમિલી ડે નિમિત્તે બ્રામ્પટનમાં રિક્લિએશન સેન્ટર્સ માટે કામકાજના કલાકોની વિગતો [અહીં જોઈ શકાય છે](#).

ब्राम्पटन ऐनिमल सर्विसीस

सोमवार, इेब्रुआरी 18 नां रोज ब्राम्पटन ऐनिमल शेक्टर बंध रडेशे. ब्राम्पटन ऐनिमल सर्विसीस अंगे वधु माडिती मेणववा, [अडी क्लिक करो.](#)

ब्राम्पटन लाईब्रेरी

सोमवार, इेब्रुआरी 18 नां रोज ब्राम्पटन लाईब्रेरीनी तमाम शाखाओ बंध रडेशे. तमारा इेमिली डे नां भाग तरीके, स्ट्रीमिंग मूवीस अने म्युजिक अलमावी लुओ, अथवा ईबुक वांचो! अमारा डिजिटल उत्पादो, कार्यक्रमो अने सेवाओ अंगे वधु माडिती माटे, वेबसाईट www.bramptonlibrary.ca लुओ अथवा 905.793.4636 नंबर पर डोन कॉल करो.

-30-

मिडिया संपर्क:

मोनिका डुग्गल

डिजिटल, मिडिया अने कम्युनिटी एंगेजमेन्ट

व्युदात्मक संवाद

सीटी ओइ ब्राम्पटन

905-874-3426 | Monika.Duggal@brampton.ca